

ક્રિમી.પરચુરણ અરજી નંબર:1118-2023

અરજદારની ફોજદારી કાર્યરીતી અધિનીયમ ની કલમ ૪૫૧ અને ૪૫૭ મુજબની
અરજી લગત હુકમ

અરજદારની હાલની અરજી વંચાણે લીધી. અરજદાર તથા વિધવાન એ.પી.પી.શ્રીને સાંભળ્યા, રજુ દસ્તાવેજો ધ્યાને લીધા. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તેમજ રજુ દસ્તાવેજો ધ્યાને લીધા.

હાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે તેઓ અરજીમાં જણાવ્યા મુજબના સરનામે હાલમા રહે છે તથા તેઓની સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ જે બનાવમાં તેઓના **CANARA BANK (including syndicate bank) નાં ખાતા નંબર: 2709101014799 માંથી રૂપિયા 48981/-** ઉપડી ગયેલ હતા જે બાબતે તેઓએ આશ્વત્ પ્રોજેક્ટમાં ૧૦૦ નંબર ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવેલ હતી. જે ફરિયાદ તારીખ 15/11/2022 નાં રોજ એકનોલેજમેન્ટ નં. **31111220074867** થી નોંધાયેલ હતી. જે સબબ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સામાવાળાની બેંક **UNION BANK (including ANDHRA BANK AND CORPOTATION BANL) & BANK OF BARODA(including VIJAYA BANK AND DENA BANK) & PUNJAB NATIONAL BANK (including ORIENTAL BANK OF COMMERCE AND UNITED BANK OF INDIA)&PUNJAB NATIONAL BANK (including ORIENTAL BANK OF COMMERCE AND UNITED BANK OF INDIA)** નાઓના ખાતા નં. **552305040000518/26450100012276/0047010167762/4498000100047522** માં તેઓના ગયેલ નાણા રૂ. **3850/-, 5000/-, 15660/-, 2000/-** ફોજદારી કાર્યરીતી અધિનીયમ ની કલમ ૧૦૨ મુજબ ફીઝ કરાવેલ હતા જે હાલ સુધી સદર બેંકમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં જણાવેલ છે કે આ બાબતે એફ.આઈ.આર. થયેલ નથી. તેઓને ખુબજ મોટુ આર્થિક નુકશાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર રૂપિયાની જરૂર હોય સદર નાણાં તેઓના ખાતામાં પરત અપાવવા માટે હાલની અરજ કરેલ છે.

અરજદારની અરજી સબબ તપાસ કરનાર અમલદાર એટલે કે પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઈડી ક્રાઇમ, ગાંધીનગરના ઓને સદર ગુના બાબતે તામામ પેપર સહીત સ્પસ્ટ અભિપ્રાય રજુ કરવા હુકમ કરવામાં આવેલ.

જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઈડી ક્રાઇમ, ગાંધીનગર નાઓએ અભિપ્રાય રજુ કરેલ છે. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તથા લગત કાગળો ધ્યાને લેતા તેઓએ જણાવેલ છે કે, સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાણા જ્યારે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતા હોય છે ત્યારે આવા નાણાંને તાત્કાલીક રોકવા તથા ગુના અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ સામાન્ય નાગરીકો માટે શરૂ કરવામાં આવેલ છે. જે હાલ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઈ.ડી. ક્રાઇમ હસ્તક ચાલુ છે અને તેઓ નાયબ પોલીસ અધિક્ષક તરીકે આ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ખાતે ફરજ બજાવે છે. આ

પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાણા આ જ્યારે ઓનલાઇન ટ્રાન્સફર થઈ જતા હોય છે તેને તાત્કાલીક રોકવાની કામગીરી કરવામાં આવે છે. સાયબર ક્રાઇમના ભોગ બનનાર નાગરીકો સીધી જ પોતાની ફરિયાદ ૧૦૦ નંબર (હાલ ૧૯૩૦) પર ડાયલ કરીને લખાવે છે ત્યારે ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ દ્વારા એક ટીકીટ આપવામાં આવે છે તેમજ સાથોસાથ જે શંકાસ્પદ બેંક ખાતામાં જે તે નાગરીકના નાણા ગયેલ હોય તે બેંકને નાણા ફીઝ કરાવવા તેમજ જો નાણા ત્યાંથી ટ્રાન્સફર થઈ ગયેલ હોય તો તેની માહિતી આપવા માટે તેઓની કચેરીએથી સીઆરપીસીની કલમ ૯૧ તથા ૧૦૨ હેઠળ નોટીસ આપવામાં આવે છે. નોટીસ આધારે બેંકો દ્વારા આ શંકાસ્પદ રીતે મેળવાયેલા નાણાં આ ફીઝ કરવામાં આવે છે.

નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઈ.ડી. ક્રાઇમ, ગાંધીનગર નાઓએ વધુમાં જણાવેલ છે કે, હાલના અરજદારનાઓ સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ હતો. જેમાં અરજદારની બેંક, **CANARA BANK (including syndicate bank)** નાં ખાતા નંબર: 2709101014799 માંથી રૂપિયા 48981/- ઉપાડી ગયેલ હતા. જે બાબતે અરજદારે આશ્વસ્ત પ્રોજેક્ટમાં ૧૦૦ નંબર ઉપર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવેલ હતી. જે ફરિયાદ આધારે અરજદારને એકનોલેજમેન્ટ નં. 31111220074867 આપવામાં આવેલ. આ અરજદાર ની ફરિયાદ આધારે સાયબર ક્રાઇમ સેલ સીઆઈડી ક્રાઇમ દ્વારા અરજદારના ઉપરોક્ત ખાતામાંથી ગયેલ નાણા પૈકી સામાવાળાની શંકાસ્પદ બેંક, **UNION BANK (including ANDHRA BANK AND CORPOTATION BANL) & BANK OF BARODA(including VIJAYA BANK AND DENA BANK) & PUNJAB NATIONAL BANK (including ORIENTAL BANK OF COMMERCE AND UNITED BANK OF INDIA)&PUNJAB NATIONAL BANK (including ORIENTAL BANK OF COMMERCE AND UNITED BANK OF INDIA)** નાઓના ખાતા નં. 552305040000518/26450100012276/0047010167762/4498000100047522 માં તેઓના ગયેલ નાણા રૂ. 3850/-, 5000/-, 15660/-, 2000/- ફોજદારી કાર્યરીતી અધિનીયમ ની કલમ ૧૦૨ મુજબ ફીઝ કરાવેલ છે. જે નાણા પાછા ખેંચવા માટે અરજદારશ્રી એ આપ નામદાર સાહેબની કોર્ટમાં અરજી કરેલ હોય અને તે સારું તેઓનો અભિપ્રાય માંગેલ છે. જે બાબતે તેઓએ જણાવેલ છે કે અરજદાર શ્રીએ સામાવાળા શંકાસ્પદ બેંક, **UNION BANK (including ANDHRA BANK AND CORPOTATION BANL) & BANK OF BARODA(including VIJAYA BANK AND DENA BANK) & PUNJAB NATIONAL BANK (including ORIENTAL BANK OF COMMERCE AND UNITED BANK OF INDIA)&PUNJAB NATIONAL BANK (including ORIENTAL BANK OF COMMERCE AND UNITED BANK OF INDIA)** નાઓના ખાતા નં. 552305040000518/26450100012276/0047010167762/4498000100047522 માં તેઓના ગયેલ નાણા રૂ. 3850/-, 5000/-, 15660/-, 2000/- ફીઝ થયેલ છે જે સદર બેંક ખાતા બનાવટી હોવાનું જણાવેલ છે તથા સદર હુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી જેથી તે રૂપિયા અરજદારશ્રીને પાછા આપવા તેઓનો અભિપ્રાય થાય છે.

સદર કામે અરજી સાથે રજુ કરવામાં આવેલ બેંક પેપર્સ ની નકલ ધ્યાને લેતા તેમજ કરનાર અમલદાર દ્વારા રજુ કરવામાં આવેલ અભિપ્રાય તથા તેને લગત કાગળો ધ્યાને લેતા તે હકીકત સ્પષ્ટ થાય છે કે હાલના અરજદારના બેંક, **CANARA BANK (including syndicate bank)** નાં ખાતા નંબર: 2709101014799 માંથી રૂપિયા 48981/- ઉપડી ગયેલ તેમજ સદર નાણાં શંકાસ્પદ બેંક, **UNION BANK (including ANDHRA BANK AND CORPOTATION BANL) & BANK OF BARODA(including VIJAYA BANK AND DENA BANK) & PUNJAB NATIONAL BANK (including ORIENTAL BANK OF COMMERCE AND UNITED BANK OF INDIA)&PUNJAB NATIONAL BANK (including ORIENTAL BANK OF COMMERCE AND UNITED BANK OF INDIA)** નાઓના ખાતા નં. 552305040000518/26450100012276/0047010167762/4498000100047522 માં ગયેલ હોય અરજદાર દ્વારા આશ્વસ્ત પ્રોજેક્ટમાં ૧૦૦ નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવેલ હતી જે ફરિયાદ તારીખ 15/11/2022 ના રોજ એકનોલેજમેન્ટ નં. 31111220074867 નંબરથી નોંધાયેલ હતી. આમ સદર હકીકત ધ્યાને લેતા અરજદારના ઉપર જણાવ્યા મુજબના ખાતામાંથી નાણા ઉપડી ગયેલ હોવાનું તથા શંકાસ્પદ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયાનું હાલના તબક્કે સ્પષ્ટ જણાઈ આવે છે. તદ્ઉપરાંત રેકર્ડ પરની હકીકત ધ્યાને લેતા હાલના કામે આજદિન સુધી કોઈ એફ.આઈ.આર થયેલ હોય કે હાલના કામે કોઈની ઘરપકડ કરવામાં આવેલ હોય તેમ જણાઈ આવતું નથી તેમજ બનાવ બન્યે આટલો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં આજદિન સુધી અરજદાર સિવાય અન્ય કોઈએ સદર નાણાની અત્રેની અદાલત સમક્ષ માગણી કરતી કોઈ અરજી કરેલ નથી તદ્ઉપરાંત તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય ધ્યાને લેતા તેઓ સમક્ષ પણ કોઈએ આ નાણાની માગણી કરેલ હોય તેમ જણાતું નથી તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાવેલું છે તથા સદર હુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધો તકરાર લીધેલ નથી જેથી તપાસ કરનાર અમલદાર દ્વારા સદર નાણા અરજદારશ્રીને પાછા આપવા સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. જેથી અત્રેની અદાલતના માનવા મુજબ હાલના અરજદાર સદર નાણાનો કબજો મેળવવા હક્કદાર હોવાનું જણાય છે.

આ તબક્કે સદર નાણા પરત આપવા બાબતે અત્રેની અદાલતની સત્તા હકુમત જોતા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ની કલમ ૪૫૭ માં નીચે મુજબ જોગવાઈ કરવામાં આવેલ છે—

457.Procedure by police upon seizure of property.
(1) Whenever the seizure of property by any police officer is reported to a Magistrate under the provisions of this code, and such property is not produced before a Criminal court during an inquiry or trial, the Magistrate may make such order as he thinks fit respecting the disposal of such property or the delivery of such property to the person entitled to the possession thereof, or if such person can not be ascertained. respecting the custody and production of such

property.

(2) If the person so entitled is known, the Magistrate may order the property to be delivered to him on such conditions (if any) as the Magistrate thinks fit and if such person is unknown, the Magistrate may detain it and shall, in such case, issue a proclamation specifying the articles of which such property consists, and requiring any person who may have a claim thereto, to appear before him and establish his claim within six months from the date of such proclamation.

આમ ફોજદારી કાર્યરીતિ અધિનીયમની કલમ ૪૫૭(૧) માં જણાવ્યા મુજબ જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી દ્વારા મિલકતની જમીની જાણ મેજિસ્ટ્રેટને કરવામાં આવે અને તપાસ દરમિયાન આવી મિલકત અદાલત સમક્ષ રજુ કરવામાં આવેલ ન હોય ત્યારે મેજિસ્ટ્રેટને આવી મિલકતના નિકાલ અથવા તો કબ્જા બાબતે યોગ્ય લાગે તેવો હકમ કરવાની સત્તા આપવામાં આવેલ છે તદઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગોવિંદભાઈ તેજાભાઈ બારીયા વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૧ (૨) જીએલએચ ૭૨૬ ના કેસમાં પેરા નં. (૯.૨), (૧૦) તથા (૨૨)માં પણ મુજબ ઠરાવેલ છે.

(9.2.)Shri Pandya has cited so many authorities with regard to legal possession of Sec. 451 and Sec. 452 of CrPC Here in this case owner lodged a complaint in the police station for which offence has been registered for theft having been committed in respect of two vehicles. That two vehicles have been found from the possession of the purchaser but at the same time the Investigating Officer has come to a conclusion that complainant has filed a false case and there fore muddamal vehicles are seized during the course of the police investigation and Investigating Officer has reported about such seizure of two vehicles, from the purchaser to the Court and there fore Section 457 of CrPC will be applicable. In no case Sec. 451 CrPC will be applicable to this case. Sec. 457 of CrPC reads as follows:

"Sec.457 Procedure by police upon seizure of property:
[(a) Whenever the seizure of property by any police officer is reported to a Magistrate under the provisions of this Code, and such property is not produced before a Criminal Court during an inquiry of trial, the Magistrate may make such order as he thinks fit respecting the disposal of such property or the delib=very of such property to the person entitled to the possession there of, or if such person can not be ascertained, respecting the custody and production

of such property.]

"(2) If the person so entitled is known, the Magistrate may order the property to be delivered to him on such conditions (if any) as the Magistrate thinks fit and if such person is unknown, the Magistrate may detain it and shall in such case issue a proclamation specifying the articles of which such property consists, and requiring any person who may have a claim there to, to appear before him and establish his claim within six months from the date of such proclamation."

(10.) On reading aforesaid section, it is crystal clear that words "may make such order as he thinks fit" are of much importance. When word 'may' is used discretion has been given to the learned Magistrate, of course that discretion is to be exercised judicially keeping in mind the well settled principles of law. The words "to the person entitled to the possession thereof" are also important and relevant. **From the papers if the learned Magistrate has come to a conclusion that particular person is entitled to the possession of the vehicles then he can pass the order directing the muddamal article to be handed over to that person.** From record it appears that the purchaser has paid Rupees 3,10,000/-- to the owner of the vehicles and Society was knowing about the fact that owner has already sold vehicle to purchaser.

(22.) As discussed earlier, when the learned Magistrate has followed the decision of this Court, in Hussain Amibhai Qureshi (supra), it cannot be said that he has passed an order contrary to well settled legal position with regard to return of muddamal articles under Sec. 457 of CrPC pending the inquiry.

આમ ઉપર ચર્ચા કર્યા મુજબ સદર કેસની તમામ હકીકત, સંજોગોતથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતા સદર નાણા બેંકમાં જમા હોય તેથી સદર રોકડ રકમનાં દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમજ ભવિષ્યે પણ મુદ્દામાલની ઓળખ બાબતની કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુમાં નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૩ (૧) જી.એલ.એચ. પાના નંબર ૩૦૭ ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાને લેતા પણ ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમઆં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

હુ ક મ

અરજદારની અરજી આથી ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૪૫૭ હેઠળ આથી મંજૂર કરવામાં આવે છે.

અરજદારને સદર ગુનાના કામે સીઝ કરવામાં આવેલ રોકડ રકમ રૂપીયા

રૂ.3850/-,5000/-,15660/-,2000/- કુલ રૂ.26510/- પુરા દોઢી રકમના જાત જામીન (બોન્ડ) તથા તેટલી જ રકમના સદ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેથી આ કેસના આખરી નિકાલ સુધી નીચેની શરતો ને આધીન વચગાળાની કસ્ટડી સ્વરુપે પરત સોંપવામાં આવે છે.

વધુમાં હુકમ કરવામાં આવે છે કે અરજદાર દ્વારા હુકમ મુજબના જાત જામીન (બોન્ડ) તથા સદ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેથી પોલીસ અધિકારી દ્વારા તે મતલબની જાણ તથા સદર હુકમની જાણ જે તે બેન્કને કરવી તેમજ UNION BANK (including ANDHRA BANK AND CORPOTATION BANL) & BANK OF BARODA(including VIJAYA BANK AND DENA BANK) & PUNJAB NATIONAL BANK (including ORIENTAL BANK OF COMMERCE AND UNITED BANK OF INDIA)&PUNJAB NATIONAL BANK (including ORIENTAL BANK OF COMMERCE AND UNITED BANK OF INDIA) ને હુકમ કરવામાં આવે છે કે, તેઓને પોલીસ અધિકારી દ્વારા અરજદારે હુકમ મુજબના જાત જામીન (બોન્ડ) તથા સદ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેલ હોવાની તથા સદર હુકમની જાણ મળ્યેથી દિન-૧૦ માં તેમની બેન્કમાં ના એકાઉન્ટ નંબર: 552305040000518/26450100012276/0047010167762/449800010004752 2 માં અરજદારના જે રૂપીય રૂ.3850/-,5000/-,15660/-,2000/- કુલ રૂ.26510/- જમા છે તે રકમ CANARA BANK (including syndicate bank) નાં ખાતા નંબર: 2709101014799 માં જમા કરાવી તેની જાણ અત્રેની અદાલતને તથા લગત પોલીસ સ્ટેશનને કરવી.

શરતો-

1. અત્રેની અદાલત જ્યારે ફરમાવે ત્યારે અરજદારે આ નાણા અદાલત સમક્ષ રજુ કરવાના રહેશે.
2. ઉપરોક્ત ખાતાધારક વ્યક્તિ સદર નાણા પર કલેઈમ કરે અને પોતાનો હક/હિત પુરવાર કરેતેવા સંજોગોમાં અરજદારે સદર રકમ પરત કરવાની રહેશે.
3. આ કેસનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી અરજદારે સદર મુદ્દામાલ રોકડ નાણા અન્ય કોઈને ગીરો, બક્ષીશ કે અન્ય કોઈ રીતે ટ્રાન્સફર કરવા કરાવવા નહીં.
4. સદર મુદ્દામાલ રકમનો કોઈ ગુનાહીત કામે ઉપયોગ કરવો/કરાવવો નહીં.
5. કોઈ પણ શરતનો ભંગ થયેથી હાલનો વચગાળાનો હુકમ આપોઆપ રદ ગણાશે તથા આ મુદ્દામાલ રોકડ રકમ ફરીથી જપ્ત થવાને પાત્ર રહેશે તથા બોન્ડ અને જામીનગીરી ની રકમ પણ વસુલ કરવાને પાત્ર રહેશે.

હુકમ આજ રોજ ખુદી અદાલતમાં વાંચી સંભળાવી સહી કરીને જાહેર કર્યો.

તારીખ ૧૩-૦૫-૨૦૨૩
અમદાવાદ.

(હીના જીતેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ)
એડી. ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ,
કોર્ટ નં.૪, અમદાવાદ.
યુનિક કોડ નં. જીજે-૦૧૧૭૨.